

13 προσδεχόμενοι τὴν μακαρίαν ἐλπίδα, καὶ ἐπιφάνειαν τῆς δόξης τοῦ
 राह-शैत — धन्य आशानं अने प्रकटिकरणं — महिमानं —
[G4327](#) [G3588](#) [G3107](#) [G1680](#) [G2532](#) [G2015](#) [G3588](#) [G1391](#) [G3588](#)

μεγάλου Θεοῦ καὶ Σωτῆρος ἡμῶν, Χριστοῦ Ἰησοῦ;
 महान् ईश्वर अने ઉદ્ધારક અમારે ખ્રિસ્ત ઈસુને
[G3173](#) [G2316](#) [G2532](#) [G4990](#) [G1473](#) [G5547](#) [G2424](#)

looking for the blessed hope and appearing of the glory of the great God and our Saviour Jesus Christ;

14 ὃς ἔδωκεν ἑαυτὸν ὑπὲρ ἡμῶν, ἵνα λυτρώσῃται ἡμᾶς ἀπὸ πάσης ἀνομίας,
 જેએ આપ્યું પોતાને માટે અમારે કે-જેથી છોડાવે અમને થી બધી અધર્મ
[G3739](#) [G1325](#) [G1438](#) [G5228](#) [G1473](#) [G2443](#) [G3084](#) [G1473](#) [G0575](#) [G3956](#) [G0458](#)

καὶ καθάρσιν ἑαυτοῦ λαὸν περιούσιον, ζηλωτὴν καλῶν ἔργων.
 અને શુદ્ધ-કરે પોતાને-માટે પ્રજાને ખાસ ઉત્સાહી સારું કાર્યોનો
[G2532](#) [G2511](#) [G1438](#) [G2992](#) [G4041](#) [G2207](#) [G2570](#) [G2041](#)

who gave himself for us, that he might redeem us from all iniquity, and purify unto himself a people for his own possession, zealous of good works.

15 Ταῦτα λάλει, καὶ παρακάλει, καὶ ἔλεγχε μετὰ πάσης ἐπιταγῆς. μηδεὶς σου
 આ બોલ અને ઉત્તેજન-આપ અને તાકીદ-આપ સાથે બધી અધિકારથી કોઈ તારી
[G3778](#) [G2980](#) [G2532](#) [G3870](#) [G2532](#) [G1651](#) [G3326](#) [G3956](#) [G2003](#) [G3367](#) [G4771](#)

περιφρονεῖτω.
 તિરસ્કાર-નહિ-કરે
[G4065](#)

These things speak and exhort and reprove with all authority. Let no man despise thee.